

FINANCIAL EXPRESS

27

UFM INDUSTRIES LIMITED

Regd. Office : Meherpur, Silchar, Assam - 788015, Phone: 03842 224822/996, Fax: 03842 241539
Email: ufm.investorgrievances@gmail.com; Website: ufmindl.weebly.com
CIN : L15311AS1986PLC002539

(₹ in Lakhs)

Extract of the Audited Financial Results for the year ended 31st March, 2021

Particulars	Quarter Ended 31.03.2021 Audited	Quarter Ended 31.12.2020 Un-audited	Quarter Ended 31.03.2020 Audited	Year Ended 31.03.2021 Audited	Year Ended 31.03.2020 Audited
Total Income from Operations	1,871.36	2,114.04	1,762.01	8,515.36	7,864.09
Net Profit/(Loss) before tax and exceptional items	(38.52)	103.30	57.89	152.97	113.94
Net Profit/(Loss) before tax after exceptional items	(38.52)	103.30	22.49	152.97	78.54
Net Profit/(Loss) from ordinary activities after tax	(12.49)	63.15	24.50	116.29	58.30
Total Comprehensive Income for the period (comprising profit/(loss) for the period after tax and other comprehensive income after tax)	(12.49)	63.15	24.50	116.29	58.30
Paid up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	593.26	593.26	593.26	593.26	593.26
Earnings Per Share (of Rs. 10/- each)					
- Basic and Diluted (₹)	(0.21)	1.06	0.41	1.96	0.98

NOTES TO FINANCIAL RESULTS:

- The above results have been reviewed by Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 30th June, 2021. The Statutory Auditors have carried out an audit of the above results.
- The above is an extract of the detailed format of Quarterly Financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial results are available on the Stock Exchange website and also on the Company's website www.ufmindl.weebly.com

By order of the Board For UFM Industries Limited

Sd/-

Mahabir Prasad Jain

Managing Director

DIN : 00498001

Place : Silchar

Date : 30.06.2021

FORM NO. INC-26
[Pursuant to Rule 30 of Companies (Incorporation) Rules 2014]
Advertisement to be published in Newspaper for the change in Registered Office of the Company from one state to another
Before the Central Government Northern Region Bench, Delhi
In the matter of sub-section 4 of section 13 of the Companies Act 2013 and clause (a) of sub-section (5) of Rule 30 of the Companies (Incorporation) Rules 2014 AND
In the matter of MIS GROWMORE WEALTH PRIVATE LIMITED having its Registered Office at SECOND FLOOR, KARMA, B/H NEW YORK LATI BAZAR, OPP. VIKRAM NAGAR, JOHPUR, AHMEDABAD Ahmedabad GJ 380059 IN

Notice is hereby given to General Public that the company proposes to make the application to the Central Government under section 13 of the Companies Act 2013, seeking confirmation of alteration of Memorandum of Companies of the company in term of special resolution passed at Extra Ordinary General Meeting held on MONDAY, 28 DAY OF June 2021 to enable the company to change its Registered Office from "State of Gujarat" to "State of Maharashtra". Any person whose interest is likely to be affected by the proposed change, may deliver either on MCA portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or sent by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and ground of opposition to the Regional Director at the Address B-2 WING, 2nd FLOOR, PARYAVARAN BHAWAN, CGO COMPLEX, NEW DELHI - 110003, within 14 Days of date of publication of this notice with a copy to the applicant company at its registered office at the address mentioned below:

ADDRESS OF REGISTERED OFFICE: GF - 9, H - Wing, Bldg No - 2, Rock Enclave, Next to YES Bank & SBI Sahyadri Nagar, Hindustan Naka, Chatur Industrial Area, Kharve, West, Mumbai - 400 067, India (Present Address)

For and on behalf of applicant
Nitin Shelke
(DIRECTOR)
Date: 01.07.2021
Place : Mumbai DIN: 03452514

PANTH INFINITY LIMITED

Reg. Off.: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Hanipura, Surat-395003, Gujarat (CIN: L45201GJ1993PLC114416)

Tel: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2021

Sr. No.	Particulars	Quarter ended 31.03.2021 (Audited)	Year ended 31.03.2021 (Audited)	Quarter ended 31.03.2020 (Audited)
1	Total income from operations (net)	1135.48	2164.44	379.26
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-49.36	7.64	14.97
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)#	-27.31	30.09	14.86
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-14.69	26.71	27.35
5	Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	-21.31	32.02	9.60
6	Equity Share Capital (face value of Rs. 10/- each)	1232.50	1232.50	1232.50
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	-	1026.26	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
	(a) Basic EPS	-0.12	0.22	0.22
	(b) Diluted EPS	-0.12	0.22	0.22

Notes:
1. The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter and Year ended on 31.03.2021, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year ended Financial Results are available on the Stock Exchanges websites: www.bseindia.com and www.cse-india.com and on the Company's Website: www.panthinfinity.com
2. The above financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 30th June, 2021.
3. The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.

For PANTH INFINITY LIMITED

Sd/-

Jinay Koradiya

Chairman & Managing Director (DIN: 03362317)

Place : Surat.

Date : 30.06.2021

THE BARODA RAYON CORPORATION LIMITED

Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 (T) 0261-2899555
Email-brcsurat@gmail.com | CIN - L99999GJ1958PLC00892 | Website-www.brcil.in

Extract of Standalone Audited Financial Results for the Quarter & year ended 31st March, 2021

Sr. No.	Particulars	Quarter ended 31.03.2021 (Audited)	Quarter ended 31.12.2020 (Unaudited)	Quarter ended 31.03.2020 (Audited)	Year ended 31.03.2021 (Audited)	Year ended 31.03.2020 (Audited)
1	Total income from operations	-	-	-	-	-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(11949.36)	(24.00)	(192.01)	(11984.04)	(252.92)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)#	(12331.17)	(24.00)	1865.64	(12365.85)	1804.73
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(12331.17)	(24.00)	1865.64	(12365.85)	1804.73
5	Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	(12331.17)	(24.00)	1865.64	(12365.85)	1804.73
6	Equity Share Capital	2291.14	2291.14	2291.14	2291.14	2291.14
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	-	-	-	(37250.33)	(24,884.84)
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)					
	Basic:	(53.82)	(0.10)	8.14	(53.97)	7.88
	Diluted:	(53.82)	(0.10)	8.14	(53.97)	7.88

Note:
The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly & year to date Financial Results are available on the Bombay Stock Exchange websites. (www.bseindia.com) and company's website www.brcil.in.

For The Baroda Rayon Corporation Limited

Sd/-

Damodarbhaj Patel

Managing Director

DIN-00056513

Date : 30-06-2021

Place : Surat.

VEGETABLE PRODUCTS LIMITED

CIN : L01122WB1953PLC021090

Regd. Office : Subot Dutt Building, 13, Brabourne Road, 6th Floor, Kolkata 700 001, (W.B.), India
Telephone : +91 33 2231 5686, E-mail : info@vegetableindia.com, Website : www.vegetableindia.com

STATEMENT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2021

(Rs. in Lakhs)

PARTICULARS	Quarter ended March 31, 2021 (Audited)	Quarter ended Dec. 31, 2020 (Un-Audited)	Quarter ended March 31, 2020 (Audited)	Year ended March 31, 2021 (Audited)	Year ended March 31, 2020 (Audited)
Total income from operations (net)	10,366	10,523	13,187	42,881	49,541
Net Profit / (Loss) from ordinary activities after tax	-26,141	7,340	-31,885	-15,521	-12,543
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	-26,216	7,340	-31,988	-15,596	-12,646
Equity Share Capital	1092,000	1092,000	1092,000	1092,000	1092,000
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	0,000	0,000	0,000	5262,089	5287,264
Earnings Per Share (before extraordinary items) (of Re. 1/- each)					
Basic :	-0.024	0.007	-0.029	-0.014	-0.012
Diluted :	-0.024	0.007	-0.029	-0.014	-0.012
Earnings Per Share (after extraordinary items) (of Re. 1/- each)					
Basic :	-0.024	0.007	-0.029	-0.014	-0.012
Diluted :	-0.024	0.007	-0.029	-0.014	-0.012

Note :

The above is an extract of the detailed format of Standalone audited Financial Results for the Quarter and Year ended 31.03.2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Year ended 31.03.2021 is available on the Company's and Stock Exchange websites.

Company's website : http://www.vegetableindia.com/investor.html

BSE Limited : www.bseindia.com

Notes :

- The said financial results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company at their respective meetings held on 30th June, 2021.
- In accordance with the requirements under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have performed a limited review of the financial results of Vegetable Products Limited for the quarter and year ended 31st March 2021. There are no qualifications in the limited review report issued for the said period.

For and on behalf of the Board of

Vegetable Products Limited

Sd/-

Ramesh Chand Daga

DIN : 00080751

Managing Director

Place : Kolkata

Date : 30th June, 2021

THIRANI PROJECTS LIMITED

CIN : L45209WB1983PLC036538

Regd. Office : Subot Dutt Building, 13, Brabourne Road, Mezzanine Floor, Kolkata 700 001, (W.B.), India
Telephone : 033 2231 5686, E-mail : thiraniprojects@gmail.com, Website : www.thiraniprojects.com

STATEMENT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2021

(Rs. in Lakhs)

PARTICULARS	Quarter ended March 31, 2021 (Audited)	Quarter ended Dec. 31, 2020 (Un-Audited)	Quarter ended March 31, 2020 (Audited)	Year ended March 31, 2021 (Audited)	Year ended March 31, 2020 (Audited)
Total income from operations (net)	8,165	28,257	22,337	88,938	95,070
Net Profit / (Loss) from ordinary activities after tax	-30,210	19,844	1,537	-17,409	-6,488
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	-30,210	19,844	1,537	-17,409	-6,488
Equity Share Capital	2021,288	2021,288	2021,288	2021,288	2021,288
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	0,000	0,000	0,000	72,496	89,756
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each)					
Basic :	-0.149	0.098	0.008	-0.086	-0.032
Diluted :	-0.149	0.098	0.008	-0.086	-0.032
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each)					
Basic :	-0.149	0.098	0.008	-0.086	-0.032
Diluted :	-0.149	0.098	0.008	-0.086	-0.032

Note :

The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended 31.03.2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Year ended 31.03.2021 is available on the Stock Exchange websites.

Company's website : http://www.thiraniprojects.com/financial-result.php

BSE Limited : www.bseindia.com

Notes :

- The said financial results were reviewed by the Audit Committee and were thereafter approved by the Board of Directors of the Company at their respective meetings held on 30th June 2021.
- In accordance with the requirements under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have performed a limited review of the financial results of Thirani Projects Limited for the quarter and year ended 31st March, 2021. There are no qualifications in the limited review report issued for the said period.

For and on behalf of the Board of

Thirani Projects Limited

Sd/-

Utpal Dey

DIN : 06931935

Managing Director

Place : Kolkata

Date : 30th June, 2021



SHEKHAWATI

SHEKHAWATI POLY-YARN LIMITED

[An ISO 9001:2015 Certified Company]

Extracts of Statement of Audited Financial Results for the Quarter and Year ended March 31, 2021

(₹ in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended 31-Mar-21 Audited	Quarter Ended 31-Dec-20 Unaudited	Quarter Ended 31-Mar-20 Audited	Year Ended 31-Mar-21 Audited	Year Ended 31-Mar-20 Audited
1	Total income from operations (net)	1,301.11	852.47	2,541.71	3,001.81	16,349.43
2	Net Profit / (Loss) for the period from ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary items)	(6.77)	(204.10)	(807.01)	(1,143.95)	(2,110.05)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(6.77)	(204.10)	(807.01)	(1,143.95)	(2,110.05)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(6.77)	(204.10)	(807.01)	(1,143.95)	(2,110.05)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(1.31)	(201.72)	(795.18)	(1,131.33)	(2,100.50)
6	Equity Share Capital (Face Value Rs. 1/- per share)	3,447.00	3,447.00	3,447.00	3,447.00	3,447.00
7	Reserve (excluding revaluation reserves) as per balance sheet of previous accounting year	-	-	-	-	(10,323.73)
8	Earnings per share (after extraordinary items) (of Rs. 1/- each) *	(0.00)	(0.06)	(0.23)	(0.33)	(0.61)
	(a) Basic	(0.00)	(0.06)	(0.23)	(0.33)	(0.61)
	(b) Diluted	(0.00)	(0.06)	(0.23)	(0.33)	(0.61)

Note : The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended March 31, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the Financial Results for the quarter and year ended March 31, 2021 is available on www.bseindia.com and www.shekhawatiyam.com.

For and on Behalf of Board

For Shekhawati Poly-Yarn Limited.

Sd/-

Mukesh Rula

Chairman & Managing Director

(DIN : 00372083)

Place : Mumbai

Date : 29th June, 2021

Registered office:

Plot No. 185/1, Naroli Village, Near Kanadi Phatak, Naroli - 396235, Dadar & Nagar Haveli (U.T.).

Tel. No.: 0260-2650666, Email: ho@shekhawatiyam.com, Website: www.shekhawatiyam.com

CIN: L17120DN1980PLC000440

ELECTRONICA FINANCE LIMITED

Aundmbar, Plot No.101/1, Erandwane, Dr Ketkar Road, Pune 411004, Maharashtra, India

DEMAND NOTICE

Demand Notice Under Section 13 (2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("Act") read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 ("Rules").

Whereas the undersigned being the Authorised Officer of **Electronica Finance Limited (EFL)** under the Act and in exercise of powers conferred under Section 13 (2) read with Rule 3 of the Rules already issued detailed Demand Notice dated below under Section 13(2) of the Act, calling upon the Borrower(s)/Co-Borrower(s)/ Guarantor(s) (all singularly or together referred to "Obligors"/Legal Heir(s)/Legal Representative(s) listed hereunder, to pay the amount mentioned in the respective Demand Notice, within 60 days from the date of the respective Notice, as per details given below. Copies of the said Notices are served by Registered Post A.D. and are available with the undersigned, and the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours.

In connection with the above, Notice is hereby given, once again, to the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) to pay to EFL, within 60 days from the date of the respective Notice(s), the amount indicated herein below against their respective names, together with further interest as detailed below from the respective dates mentioned below in column (d) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Obligor(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to EFL by the said Obligor(s) respectively.

Loan Account No.	Name of Obligor(s)/ Legal Heir(s)/Legal Representative(s)	Total Outstanding Dues (Rs.) as on below date*	Date of Demand Notice & Date of NPA
179-953890-2019-59-1	1. Anuj Trading Co., Through its Proprietor Mr. Nareshkumar Dayabhai Parmar (Borrower) 2. Mr. Nareshkumar Dayabhai Parmar (Borrower) 3. Mr. Dineshkumar Dayabhai Parmar (Co-Borrower) 4. Mr. Dayabhai Lavjibhai Dalvadi (Co-Borrower) 5. Mrs. Savitaben Dayabhai Dalvadi (Co-Borrower)	Rs. 32,54,181/- (Rupees Thirty Two Lakhs Fifty Four Thousand One Hundred Eighty One Only) as on 22.06.2021	24.06.2021 05.12.2020

Schedule A: Description of the Mortgaged Property No.1- All piece and parcel of immovable property being at, Halvad, Industrial Plot at R.S. No. 2580/P1, Paiki Plot No. 18, Admeasuring 390.14 Sq.mt., Situated on the land of Village Halvad, Sub District Halvad, District Morbi, Gujarat.

Bounded By: East: Mt. 9 Wide Road, West: Plot No. 19, North: Plot No.17, South: Mt. 10.50 Wide Road

Schedule-B: Description of the Mortgaged Property No.2- All piece and parcel of immovable property at Dhrangadhra-Maliya, Highway Road, Sh

